

MADHUVeer COM 18 NETWORK LIMITED

Reg. Office.: Office No # 812, Anand Mangal - III, Opposite Core house, Near Hirabag,
Near Rajnagar Club, Ambawadi, Ahmedabad-06 | Phone - 9773151363
Email: tohealpharmachem@gmail.com CIN: L24230GJ1995PLC026244

August 13, 2024

To,
The Manager,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai - 400001
Scrip Code: 531910

Dear Sir,

Sub: Submission of Copies of publication of Newspaper Advertisements for convening Extra Ordinary General Meeting on Wednesday, September 4, 2024.

Pursuant to Section 108 of the Companies Act, 2013 and the rules made thereunder and pursuant to Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and other applicable provisions if any, the Company has published Newspaper Advertisement in One (1) English - Business Standard newspaper and One (1) Regional Language Newspaper - Gujarati - Jai Hind for convening the Extra Ordinary General Meeting no. 1/2024-25 of members of the Company on Wednesday, September 4, 2024 to pass special resolution to issue 1 crores equity shares on preferential basis in accordance with the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosures Requirements) Regulations, 2018.

Please find enclosed the copies of the publication of the same along with this letter.

Kindly take the same on your record.

Thanking you,
Yours faithfully,

For, Madhuveer Com 18 Network Limited


Himani Vora
(Company Secretary & Compliance Officer)
Membership No. 73750



Encl: a/a.

SHILCHAR TECHNOLOGIES LIMITED					
Regd. Office : Near Muval Sub Station, Padra Jambusar Highway, Gavasad, Vadodara - 391430, Gujarat, India. Phone No. +91 7624090901/2, Email : info@shilchar.com Website : shilchar.com CIN : L29306GJ1986PLC008387					
EXTRACT OF STANDALONE UNAUDITED RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2024 (Rs. in Lakhs except EPS)					
Sr. No.	Particulars	Unaudited	Audited	Unaudited	Audited
		Quarter ended 30th June, 2024	Quarter ended 31st March, 2024	Quarter ended 30th June, 2024	Quarter ended 31st March, 2024
1	Total Income from Operations (Net)	11,037.64	10,889.96	6,978.80	40,971.16
2	Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and / or Extraordinary Items)	3,210.71	3,410.78	2,177.38	12,332.47
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and / or Extraordinary Items)	3,210.71	3,410.78	2,177.38	12,332.47
4	Net Profit / (Loss) for the period (After Tax, Exceptional and / or Extraordinary Items)	2,397.77	2,501.81	1,638.06	9,188.81
5	Total Comprehensive Income for the period (Profit/Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	2399.78	2503.28	1639.95	9195.95
6	Paid-up Equity share capital of Rs. 10 each	762.68	762.68	381.34	762.68
7	Reserve (Including Reserves)	-	-	-	20,196.15
8	Earnings per share of Rs.10/- each for continuing and discontinued operations)				
	A. Basic	31.44	32.80	42.96	120.48
	B. Diluted	31.44	32.80	42.96	120.48

NOTE : (1) The above unaudited results were reviewed by Statutory Auditors, recommended by Audit Committee and approved by Board of Directors. (2) The activities of the Company relate to only one segment i.e. Transformers & Parts. (3) The figures for the quarter ended 31st March, 2024 are the balancing figures between the audited figures in respect of the full financial year ended 31st March, 2024 and year to date unaudited figures upto 31st March, 2024. (4) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the consolidated quarterly financial results are available on stock exchange website www.bseindia.com and on Company's website www.shilchar.com.

By order of the Board of Directors
For SHILCHAR TECHNOLOGIES LIMITED
Sd/-
ALAY SHAH (MANAGING DIRECTOR) (DIN 00263538)

Date : 12th August, 2024
Place : Bil, Vadodara

पंजाब नैशनल बैंक Punjab National Bank
Bharuch Branch, Bharuch

Appendix-IV [See Rule 8(1)] SYMBOLIC POSSESSION NOTICE (For immovable Property)
Whereas, the undersigned being the authorized officer of the Punjab National Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 05.06.2024 Calling upon the Borrower/Guarantor/Mortgagor **Mr. Solanki Bhavnaben Devendrasinh** to repay the amount mentioned in the notice being **Rs. 9,50,658.45 (Rupees Nine Lakhs Fifty Thousand Six Hundred Fifty Eight and Forty Five Paise Only)** as on **30.04.2024** with Further Interest and charges at the contracted rate until payment in full within 60 days from the date of Notice/date of receipt of the said notice.
The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this **06th Day of August of the year 2024**.
The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an amount **Rs. 9,50,658.45 (Rupees Nine Lakhs Fifty Thousand Six Hundred Fifty Eight and Forty Five Paise Only)** as on **30.04.2024** with future interest and charges at the contracted rate until payment in full.
The borrower's/Guarantor's/Mortgagor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
All that property Situated at plot No. AA/14, Sanidhya Bunglows, Village-Bholav, Bharuch (Gujarat), Revenue Survey no.50 & 51 paiki Surya Narayan Paiki Plot no.1511 to 1518 and 1536 to 1540, Plot Area 92.75 Sq.Mts and G F area 71.56 Sq.Mts F.F.60.40 Sq. Mtrs. & built up area 998 Sq. ft. Boundaries: East: Plot No-AA/13, West: Plot No-AA/15, North: Plot No-AA/03, South: Public Road.

Date: 06.08.2024 Place: Bharuch
Authorized Officer - Punjab National Bank

OSBI State Bank of India - Silvasa (06596)
Nisharg, Apartment, NR Yogi Hospital, Silvasa.
Email : sbi.06596@sbi.co.in

POSSESSION NOTICE (For Immovable Property)
Whereas, The undersigned being the Authorized Officer of the State Bank of India under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 05/06/2024 calling upon the Mr. Mishra Satyanarayan Kantaprasad (Borrower) and Mrs. Mishra Sarladevi Satyanarayan (Guarantor) to repay the amount mentioned in the notice being **Rs. 23,78,918/- + Interest (Charges)** (Twenty Three Lakh Seventy Eight Thousand Nine Hundred Eighteen + Interest (Charges)) with interest, cost, charges, etc., within 60 days from the date of receipt of the said notice.
The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers/guarantors and the public in general that the undersigned has taken the **Symbolic possession** of the properties described herein below in exercise of powers conferred upon me under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this **06/08/2024**.
The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties will be subject to the charge of the State Bank of India, Silvasa, Nisharg, Apartment, NR Yogi Hospital for an amount of **Rs. 23,78,918/- + Interest (Charges)** (Twenty Three Lakh Seventy Eight Thousand Nine Hundred Eighteen + Interest (Charges)) mentioned in the notice and further interest thereon.
The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Property
Flat No: 105, Building No A, K.P Vihar, Survey No 400/1, Opp. Essar Petrol Pump, Dadra, Dadra Nagar Haveli 396230
Date : 06/08/2024
Place : Silvasa
Authorized Officer & Chief Manager, State Bank of India.

Bank of Baroda E-AUCTION SALE NOTICE
Sr.No.1 to 27 Dt. : 06/09/2024
Sr.No.28 to 30 Dt. : 20/09/2024
Time : 2:00 to 6:00 PM

E-Auction Sale Notice for Sale of Movable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) / Mortgagor and Guarantor (s) that the below described immovable / movable property mortgaged / charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" and "Without recourse" basis for recovery of dues in below mentioned account/s, liability of any dues identified will be upon the purchaser but not upon the Banker.

Sr. No.	Borrowers/ Guarantors/ Mortgagors	Description of Property	Dues in lacs + Int. & Charges (Less Recovery if any)	Res.Price EMD (In lacs)	Nature of Property	Possession Type
1.	M/s. Rivan Textiles Chirag Govardhanbhai Vaghani	Unit/Office No. C.H.-402 admeasuring about 1541.00sq.ft.s. i.e. 143.16 sq. meters. super built up area & 1256.40 sq. ft. i.e. 116.82 sq. mtrs. built up area & 047.00 sq. ft. i.e. 97.35 sq. mtrs. carpet area (the said shop is identified as Tenement No. 07D-21-9111-0-001 in S.M.C. records) on the 4th floor of building known as "Belgium Chamber" of Silver Plaza Complex together with undivided proportionate share of land underneath the said building situated in "Silver Plaza Complex" constructed on land bearing Nondh No. 4824/A of City Survey Ward No. 7, in ring road area of the city, Taluka Surat city and District Surat	110.51 + Int. & legal Charges	37.45 3.75	Shop	Physical
2.		Unit/Office No. C.H.-404 admeasuring about 493.00 sq.fts. i.e. 45.80 sq. meters. super built up area & 402.29 sq. ft. i.e. 37.37 sq. mtrs. built up area & 335.24 sq. ft. i.e. 31.14 sq. mtrs. carpet area (the said shop is identified as Tenement No. 07D-21-9115-001 in S.M.C. records) on the 4th floor of building known as "Belgium Chamber" of Silver Plaza Complex together with undivided proportionate share of land underneath the said building situated in "Silver Plaza Complex" constructed on land bearing Nondh No. 4824/A of City Survey Ward No. 7, in ring road area of the city, Taluka Surat city and District Surat		11.98 1.20	Shop	Physical
3.		Unit/Office No. C.H.-406 admeasuring about 493.00sq.fts. i.e. 45.80 sq. meters. super built up area & 402.29 sq. ft. i.e. 37.37 sq. mtrs. built up area & 335.24 sq. ft. i.e. 31.14 sq. mtrs. carpet area (the said shop is identified as Tenement No. 07D-21-9121-001 in S.M.C. records) on the 4th floor of building known as "Belgium Chamber" of Silver Plaza Complex together with undivided proportionate share of land underneath the said building situated in "Silver Plaza Complex" constructed on land bearing Nondh No. 4824/A of City Survey Ward No. 7, in ring road area of the city, Taluka Surat city and District Surat		11.98 1.20	Shop	Physical
4.	M/s. Riya Textiles, Chirag Govardhanbhai Vaghani	Unit/Office No. C.H.-408 admeasuring about 493.00sq.fts. i.e. 45.80 sq. meters. super built up area & 402.29 sq. ft. i.e. 37.37 sq. mtrs. built up area & 335.24 sq. ft. i.e. 31.14 sq. mtrs. carpet area (the said shop is identified as Tenement No. 07D-21-9125-001 in S.M.C. records) on the 4th floor of building known as "Belgium Chamber" of Silver Plaza Complex together with undivided proportionate share of land underneath the said building situated in "Silver Plaza Complex" constructed on land bearing Nondh No. 4824/A of City Survey Ward No. 7, in ring road area of the city, Taluka Surat city and District Surat	110.51 + Int. & legal Charges	11.98 1.20	Shop	Physical
5.		Unit/Office No. C.H.-410 admeasuring about 500.00sq.fts. i.e. 46.45 sq. meters. super built up area & 407.00 sq. ft. i.e. 37.90 sq. mtrs. built up area & 340.00 sq. ft. i.e. 31.59 sq. mtrs. carpet area (the said shop is identified as Tenement No. 07D-21-9131-001 in S.M.C. records) on the 4th floor of building known as "Belgium Chamber" of Silver Plaza Complex together with undivided proportionate share of land underneath the said building situated in "Silver Plaza Complex" constructed on land bearing Nondh No. 4824/A of City Survey Ward No. 7, in ring road area of the city, Taluka Surat city and District Surat		12.15 1.22	Shop	Physical
6.		Unit/Office No. C.H. 428 (Tenement No. 07D-21-9185-0-001 as per SMC records) with super built up area admeasuring about 742 sq. ft. i.e. 68.93 sq. mtrs. and admeasuring about 605.47 sq. ft. i.e. 56.24 sq. mtrs. Built area & 504.56 sq.ft. i.e. 46.87 sq. mtrs. Carpet area on the 4th floor of Belgium Chamber of Silver Plaza complex constructed on land bearing nondh No. 4824/A of city survey ward No. 7 situated at Ring Road area, District Surat		18.03 1.80	Shop	Physical
7.	M/s Priyansh Textiles Jainika Chirag Vaghani, Chirag Govardhanbhai Vaghani & Chetnaben Sanjay Vasani	Unit/Office No. C. H. 424 (Tenement No. 07D-21-4511-0-001 as per SMC records) with super built up area admeasuring about 493 sq. ft. i.e. 45.80 sq. mtrs. and admeasuring about 402.29 sq. ft. i.e. 37.37 sq. mtrs. Built area & 335.24 sq.ft. i.e. 31.14 sq. mtrs. Carpet area on the 4th floor of Belgium Chamber of Silver Plaza complex constructed on land bearing nondh No. 4824/A of city survey ward No. 7 situated at Ring Road area, District Surat	86.69 + Int. & legal Charges	11.98 1.20	Shop	Physical
8.		Unit/Office No. C. H. 426 (Tenement No. 07D-21-9181-0-001 as per SMC records) with super built up area admeasuring about 493 sq. ft. i.e. 45.80 sq. mtrs. and admeasuring about 402.29 sq. ft. i.e. 37.37 sq. mtrs. Built area & 335.24 sq.ft. i.e. 31.14 sq. mtrs. Carpet area on the 4th floor of Belgium Chamber of Silver Plaza complex constructed on land bearing nondh No. 4824/A of city survey ward No. 7 situated at Ring Road area, District Surat		11.98 1.20	Shop	Physical
9.	Kalpesh Nathabhai Magatprara	Plot No C/171/1 "Aadarsh Nagar Vibhag-1", Nr Vrundavan Society, Block No 38,40,41,46 & 47/A P New Block No 38, TPS No 70, F P No 18/B, Moje Chhaprabhatia, Sub Dist Choryashi, Dist Surat Area- 54.36 Sq.mt	19.26 + Int. & legal Charges	17.50 1.75	Residential House	Physical
10.	Himmatbhai Devanshibhai Pipaliya	Residential Row house at Plot No 16 Shri Shubh Residency, Nr Vanvaso Farm-Jokha Road R S No 192/2, Block No 204, Moje-jokha Sub Dist Kamrej, Dist Surat Plot area- 75.00 Sq.yards	21.20 + Int. & legal Charges	10.31 1.03	Residential Row House	Physical
11.	Narshibhai Bijalbai Nagecha & Kailashben Narshibhai Nagocha	Residential Row House, Type property at Moje.Nansad, R.S.No.99, Block No.95 "Shakti Lake City" Vibhag -A, Plot No.225, Opp.Gokuldharm Residency, Nansad Canal Road, Nansad - 394180, Tal. Kamrej, Dist.Surat. Area Gross Area 105.64 Sq.mts.i.e. 126.35 Sq.yards	22.77 + Int. & legal Charges	19.80 1.98	Residential Row House	Physical
12.	Bharatbhai Pragjibhai Borad Chandubhai Pragjibhai Borad	Row house at Plot No 65,AMRUT RESIDENCY, VIBHAG 4 ,RS No 82,53 Paikae, Block No 91, Moje : Antroli, Sub Dist Kamrej, Dist Surat Area-84.04 Sq.Yd	21.52 + Int. & legal Charges	12.06 1.20	Residential Row House	Physical
13.	Dineshbhai Shamjibhai Sardara	Residential Row house at Plot No 5, Amrut Residency , Vibhag - 3, Near Sukhdarshan Row house, R S NO 83/Paiki +85/Paikae, Block No 92, Antroli-Velanjia Road, Antroli-394150 Tal Kamrej, Dist Surat Area 81.50 Sq.mtrs	21.04 + Int. & legal Charges	11.51 1.15	Residential Row House	Physical
14.	Anil Maganbhai Kotadiya & Kiranben Anilbhai Kotadiya	Residential Row house at Plot No 32, Amrut Residency , Vibhag - 3, Near Sukhdarshan Row house, R S NO 83 +85/Paikae, Block No 92, Antroli-Velanjia Road, Antroli-394150 Tal Kamrej, Dist Surat Area 107.52Sq.mtrs	21.95 + Int. & legal Charges	16.38 1.64	Residential Row House	Physical
15.	Kyada Vijaykumar Jayantibhai	Residential Row house type property at Plot No 113, Shri Shubh Residency, B/h Enjoy Farm, Vav-Jokha Road, R S No. 192/2 Block No 204, Moje.Jokha, Tal Kamrej, Dist Surat Area-Land Area-75.49 Smt.i.e. 90.25 Sq.yds	21.77 + Int. & legal Charges	13.14 1.32	Residential Row House	Physical
16.	Infra Mobile Sanjay Arjanbhai Pansuriya	Plot No.149,150,151,152,153 (Total 5 Plot) Manish Small Scale industrial Estate, R S No 42,43,44/1,44/2, Block No 71 Paikae 85, Opp Nayra Petrol Pump & Shiv Shakti Estate, B/h Pahal Solar, Olpad-Sayan Road, Moje Atodara, Tal Olpad, Dist Surat, Area :97.53 Sq.mt (Each Plot)	610.08 + Int. & legal Charges	36.95 3.70	Industrial Plot	Physical
17.	Akshar Thread Jari	Residential row house under construction property at Moje Shekhpur bearing R S No 260/A, Block No 222, "Nikantth Dham residency", Plot No 12, B/s Unicorn Farm, B/h Anand Vatika, Shekhpur Canal Road, Shekhpur-394130 Tal Kamrej Dist Surat Area-45.75 Sq.mts.i.e. 54.71Yards		4.23 0.43	Residential Row House	Physical
18.	Nileshbhai Dhirubhai Savaliya	Residential row house under construction property at Moje Shekhpur bearing R S No 260/A, Block No 222, "Nikantth Dham residency", Plot No 13, B/s Unicorn Farm, B/h Anand Vatika, Shekhpur Canal Road, Shekhpur-394130 Tal Kamrej Dist Surat Area-68.62 Sq.mts.i.e. 82.06 Yards		6.27 0.63	Residential Row House	Physical
19.		Residential row house under construction property at Moje Shekhpur bearing R S No 260/A, Block No 222, "Nikantth Dham residency", Plot No 14, B/s Unicorn Farm, B/h Anand Vatika, Shekhpur Canal Road, Shekhpur-394130 Tal Kamrej Dist Surat Area-68.62 Sq.mts.i.e. 82.06 Yards	48.67 + Int. & legal Charges	6.63 0.66	Residential Row House	Physical
20.	Akshar Thread Jari	Residential row house under construction property at Moje Shekhpur bearing R S No 260/A, Block No 222, "Nikantth Dham residency", Plot No 17, B/s Unicorn Farm, B/h Anand Vatika, Shekhpur Canal Road, Shekhpur-394130 Tal Kamrej Dist Surat Area-45.75 Sq.mts.i.e. 54.71 Yards		5.32 0.53	Residential Row House	Physical
21.		Residential row house under construction property at Moje Shekhpur bearing R S No 260/A, Block No 222, "Nikantth Dham residency", Plot No 18, B/s Unicorn Farm, B/h Anand Vatika, Shekhpur Canal Road, Shekhpur-394130 Tal Kamrej Dist Surat Area-64.27 Sq.mts.i.e. 76.86 Yards		7.20 0.72	Residential Row House	Physical
22.	Ravi Dineshbhai Kathiriya Radhikaben Ravi Kathiriya Dineshbhai Narubhai Kathiriya	Flat No. A/1-202, with carpet area admeasuring about 817 sq. fts. i.e. equivalent to 75.90 sq. mtrs. and built up area admeasuring 91.08 sq. mtrs. on the 2nd floor of "A-1" building together with undivided proportionate share of 46.87 sq. mtrs. in land under the said building in residential complex named and known as "Varinri Apartment" situated on land bearing Sub Plot No. 2 bearing Revenue Survey No. 144 i.e. Block No. 141 of village Sarthana, Taluka, Puna, District Surat in the name of Mr. Ravibhai Dineshbhai Kathiriya and Mrs. Radhikaben Ravi Kathiriya	22.72 + Int. & legal Charges	37.49 3.75	Residential Flat	Physical
23.	Pravin Hemshankar Purohit Geetaben Purohit	Flat No 1204, 12th Floor, Building No E "Ambika Heaven" Nr.Ambika Township, Dindoli, Flower Garden Road R.S.No.28, Block No 116, Tps No 69 (Godadara-Dindoli), F.No.104, Moje.Dindoli, Sub.Dist.Choryasti, Dist.Surat. Area-1058.00sq.ft.(BUA)	22.47 + Int. & legal Charges	22.95 2.30	Residential Flat	Symbolic
24.	Divine Communication Helli Jigneshbhai Patel	Commercial shop at Nanpura bearing Ward No 01, Nondh No 842/B, 843/B & 844/B "Megh Ratna Complex" 1st Floor Shop No.HG/5, Hathugara Maholia, Nr.Bank of Baroda, Tal.surat city, Dist.Surat, Area - Carpet area 248.00 sq.ft.i.e. 23.04 Sq.Mts as per sale deed.	26.49 + Int. & legal Charges	21.06 2.11	Shop	Physical
25.		Shop No. 168 on the Basement Floor of the market known as "Mahavir Textile Market" situated at Ring Road bearing T.P. Scheme No. 8(Umarwada), final plot No. 139 paiki, city survey Nondh Nos : 2013 + 2014, Plot No. 10 to 15 of Ward : Umarwada, Taluka: Puna (Surat City), District: Surat total admeasuring about 150.00 Sq.Ft.i.e.13.94 sq.mt		10.83 1.08	Shop	Physical
26.	Preeti Fashion Laichand Mishralal Tavari	Shop No. 175 on the Basement Floor of the market known as "Mahavir Textile Market" situated at Ring Road bearing T.P. Scheme No. 8(Umarwada), final plot No. 138 paiki, city survey Nondh Nos:2013 + 2014, Plot No. 10 to 15 of Ward : Umarwada, Taluka: Puna (Surat City), District: Surat total admeasuring about 178.00 Sq.Ft.i.e.16.54 sq.mt	149.92 + Int. & legal Charges	12.86 1.28	Shop	Physical
27.		Shop No. 184 on the Basement Floor of the market known as "Mahavir Textile Market" situated at Ring Road bearing T.P. Scheme No. 8(Umarwada), final plot No. 139 paiki, city survey Nondh Nos:2013 + 2014, Plot No. 10 to 15 of Ward : Umarwada, Taluka: Puna (Surat City), District: Surat total admeasuring about 178.00 Sq.Ft.i.e.16.54 sq.mt		12.86 1.28	Shop	Physical
28.	Sanjaybhai Dhirajlal Ginoiya Sonalben Shaileshbhai Ginoiya	Flat No. D/102 admeasuring built up area 93.50 sq. meters on the 1st Floor of D-Building of "Opera House" situated on the land bearing Block No.: 232/21, R.S. No. 229, 231, 233, 236 paikae, T.P. Scheme No. 24, F.P. No. 93/1/, of Village: Mota Varachha, Ta. City, Dist: Surat.	40.03 + Int. & legal Charges	36.22 3.62	Residential Flat	Physical
29.	M/s Kusum Creation Proprietor : Kusum Sureshkumar Malani Sureshkumar R. Malani Sushikumar R. Malani	Equitable Mortgage of Shop No. 143 L.G. Floor, Kohinoor Textile Market, Salabatpura, Ring Road, Surat.	21.21 + Int. & legal Charges	13.77 1.38	Shop	Symbolic
30.	M/s Jay Fabrics Proprietor : Nirajkumar V. Dhakud Laljabhai Ramjibhai Talaviya Kisorbhai Nanjibhai Rakholiya	All the piece and parcel of the property of Industrial Property situated at Plot No.110, Govind Nagar, R.S. No. 74/1,74/2,75,76,77,78 paiki, 79/1+2 paiki, 80,81,82 and 83 of Village Udhna -Surat.	44.00 + Int. & legal Charges	46.78 4.68	Ind. Plot	Symbolic

STATUTORY 15 DAYS SALE NOTICE FOR SR. NO. 01 TO 27 & STATUTORY 30 DAYS SALE NOTICE FOR SR. NO. 28 TO 30 UNDER SARFAESI ACT TO BORROWER / GUARANTOR / MORTGAGOR
Minimum Bid incremental Amount Rs. 10,000/- (Rs. Ten thousand only) | Inspection Start Date : 13/08/2024
For detailed terms and conditions of sale, please refer/visit to the website link <https://www.bankofbaroda.in/e-auction.htm> and online auction portal <https://ebkray.in>
Also, prospective bidders may contact the Authorised officer on Tel No. 0261-2294305/04/03/01, Mo.No.949955022
(In the event of any discrepancy between the English version and any other language version of this auction notice, the English version shall prevail)
Date : 12/08/2024 | Place : Surat | For property visit contact : Santosh Masarankar - 0261-2294305/04/03/01, 949955022
Authorized Officer, BANK OF BARODA

AIROLAM LIMITED
CIN : L20211GJ2007PLC052019
Regd. Office : Survey No. 355, Nanapur Road, N.H. No. 8, Village : Dalpur, Ta. Prantij, Himatnagar-383120, Gujarat, India.
Ph : +91 2770-240572/73, E-mail : cs1@airolam.com, Website : www.airolam.com

NOTICE OF 17th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION & BOOK CLOSURE

Notice is hereby given that:

- The 17th Annual General Meeting of the members of Airo Lam Limited will be held at the Registered Office of the Company at Survey No. 355, Nanapur Road, N.H. No. 8, Village- Dalpur, Ta. Prantij, Himatnagar 383120, Gujarat, India on **Tuesday, September 03, 2024 at 03:00 P.M.** to transact the business as set forth in the AGM Notice dated August 05, 2024.
- Electronic copies of the Notice of AGM and Annual Report for the financial year 2023-24 have been sent to all the members whose e-mail IDs are registered with the Company/ Depository Participant(s). The same are also available on the website of the Company at www.airolam.com. The AGM Notice, Proxy Form and Attendance Slip have been sent through permitted mode to all the Members, whose names appeared in the Register of Members as on August 02, 2024.
- Members holding shares either in physical form or dematerialized form, as on the cutoff date i.e. August 27, 2024, may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through electronic voting system of "Link In-Time (India) Pvt. Ltd." ("LITIP") from a place other than venue of AGM ("remote e-voting"). All the members are informed that:
 - The business as set forth in the Notice of AGM may be transacted through voting by electronic means;
 - The remote e-voting shall commence on **August 31, 2024 (09:00 A.M. IST)**;
 - The remote e-voting shall end on **September 02, 2024 (05:00 P.M. IST)**;
 - The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is **August 27, 2024**;
 - E-voting by electronic mode shall not be allowed beyond **05:00 P.M. IST on September 02, 2024**;
 - Any person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as of the cut-off date i.e. **August 27, 2024** may obtain the login ID and password in the manner as detailed in the Notice, which amongst others also prescribe that Members may call Link In-time on : Tel: 022 - 49186000 or send an e-mail request to enotices@linkintime.co.in.
 - In case of any queries on e-voting, Members may refer Help and FAQs on e-voting and User Manual for Shareholders at <https://instavote.linkintime.co.in> or contact on Tel : 022 - 49186000, E-mail ID: enotices@linkintime.co.in.
 - The Company shall also provide facility for voting through physical ballot paper at the AGM and Members attending the AGM who have not already cast their votes by remote e-voting shall be able to exercise their right to vote at the AGM. The Members, who have casted their votes by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again.
 - The Notice of AGM is available on the Company's website www.airolam.com
- The Register of Members and the Share Transfer books of the Company will remain closed from **Wednesday, August 28, 2024 to Tuesday, September 03, 2024** for annual closing.

By order of the Board of Directors
For, Airo Lam Limited,
Sd/-
Chintankumar K. Mahuriya
(Company Secretary & Compliance officer)

Place : Prantij
Date : 05.08.2024

MADHUEVER COM 18 NETWORK LIMITED
Regd. Office : Office No # 812, Anand Mangal - II, Opposite Core House, Near Hirabag, Near Rajnagar Club, Ambawadi, Ahmedabad -380006
CIN : L24230GJ1995PLC026244 | Phone : 9773151363
Email : tohealpharmachem@gmail.com | Website : www.mcom18.com

NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING NO. 1/2024-25, REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the Extra Ordinary General Meeting No. 1/2024-25 ("1st EGM") of the Members of Madhuvever Com 18 Network Limited will be held on **Wednesday, September 04, 2024 at 11:00 A.M.** at the Registered Office of the Company to transact the business, as set out in the Notice of the 1st EGM.

The Company has sent Notice of 1st EGM on Monday, August 12, 2024, to all the Members through e-mail whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent, M/s. Purva Sharegistry Private Limited/ Depository Participant (s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs vide Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs followed by Circular No. 20/2020 dated May 05, 2020, Circular No. 22/2020 dated June 15, 2020, Circular No. 33/2020 dated September 28, 2020, Circular No. 39/2020 dated December 31, 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 10/2021 dated June 23, 2021 Circular No. 21/202

કેરળ અને મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા પછી હવે સુપ્રિમના ફેસલા પર મીટ

ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ ગુનો ગણાય? સુપ્રિમનો ચુકાદો અનામત

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે (૧૨ ઓગસ્ટ) ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત કેસની સુનાવાણી કરી. કેરળ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટેમાં પડકારવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ફોન પર યાજ્ઞક સાથે સંબંધિત પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો ગુનો નહીં ગણાય. કેરળ હાઈકોર્ટે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક કેસની સુનાવાણી કરતી વખતે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ખાનગી રીતે અરલીલ ફોટા અથવા વીડિયો જોતો હોય તો તે ગુનો નથી, પરંતુ જો તે અન્ય લોકોને બતાવતો હોય તો તે ગેરકાયદેસર ગણાયો.

વસ્તુતઃ, એક એનરજીઓ એ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો જ્યારે એક આરોપીને પહેલા કેરળ હાઈકોર્ટમાં અને પછી મદ્રાસ હાઈકોર્ટમાં તેના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય હાલ પૂરતો અનામત રાખ્યો છે.

કેરળ હાઈકોર્ટે કહ્યું- પોર્ન જોવું એ વ્યક્તિની અંગત પસંદગી છે, તેમાં દખલ ન કરી શકાય.

આ નિર્ણય કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પીવી કુન્હીકુમ્બારની બેન્ચે આવ્યો છે. જસ્ટિસ કુન્હીકુમ્બારે કહ્યું હતું કે, સર્કિટમાં પોર્નોગ્રાફી પ્રચલિત છે.

અજોડ ડિજિટલ યુગમાં તે સરળતાથી ઉપલબ્ધ છે. તે યાજ્ઞક અને વધુસ્ટોની આંગળીના યેડે ઉપલબ્ધ છે. સવાલ એ છે કે કોઈ વ્યક્તિ પોતાના પ્રાઈવેટ ટાઈમમાં પોર્ન વીડિયોને બતાવવા વગર જોતા હોય તો તે ગુનો છે કે નહીં? જ્યાં સુધી કોર્ટનો સંબંધ છે, તેને અપરાધ તરિક્ક વર્ગીકૃત કરી શકાય નહીં કારણ કે તે વ્યક્તિની વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે. આમાં દખલગીરી તેની ગોપનીયતામાં ધૂસણખોરી સમાજ છે.

કેરળ હાઈકોર્ટની આ દિવસની આધાર તરિક્ક ટાંકીને, મદ્રાસ હાઈકોર્ટે ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ PCO સાઈટ્સ એક્ટ હેઠળ એક આરોપી સામેનો કેસ રદ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈના ઉપકરણ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ ડાઉનલોડ કરવી એ ગુનાના દાખરામાં નથી આવતું. કોર્ટે આ દિવસની ૨૮ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ચાલી રહેલા કેસની સુનાવાણી દરમિયાન કોર્ટ હતી. યાજ્ઞક પોર્નોગ્રાફીના આરોપમાં તે વ્યક્તિ વિરુદ્ધ PCO સાઈટ્સ (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિવ) એક્ટ અને IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સામે ચાલી રહેલા કેસને રદ કર્યો હતો.



હિંડનબર્ગનો રિપોર્ટ ભારત-શેરબજાર વિરુદ્ધ ષડયંત્ર: ભાજપ

નવી દિલ્હી તા. ૧૨ : ભારતના ટોચના ઉદ્યોગજ્ઞ સમૂહમાં નિશાન બનાવવા બાદ અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગ સેબીના ચેરપર્સન સામે તોપ તારી છે. ત્યારે સમગ્ર ઘટનાક્રમમાં રાજકીય ધમસાણા શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના આક્ષેપો સાથે તપસની માંગ કરતા નિવેદન સામે ભાજપી સમગ્ર બનાવને ષડયંત્ર ગણાવીને ભારતીય માર્કેટને અસ્થિર કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટ ભારત સામેનું મોટું ષડયંત્ર છે. લોકસભાની સંપૂર્ણિમાં સળંગ ત્રીજા દિવસી કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ તથા તેમને પ્રમોટ કરતા લોકો ભારતને આર્થિક રીતે અસ્થિર બનાવવા મદદ માટે ભાજપના નેતાએ એવો ગંભીર

પડયા છે. તેઓએ હિંડનબર્ગ રિપોર્ટના સમગ્ર વિશેસ સવાલ ઉઠાવવા કહ્યું હતું કે અમેરિકન કંપનીએ ઈરાદાપૂર્વક કોંગ્રેસના સવાલો બાદ ભાજપના વળતા પ્રહાર શનિવારે રિપોર્ટ જારી કર્યો હતો. જેને પગલે રવિવારે જનરલ ઉભો થાય અને સોમવારે ઉદ્યોગવર્તન માર્કેટ ધસી પડે. હિંડનબર્ગે દોઢ વર્ષ પૂર્વે આદાણી વિરુદ્ધ રિપોર્ટ બાંધ્યું હતું. સર્વોચ્ચ અદાલતે પોતાના કાર્યક્રમમાં જ તપસ કરાવી હતી તેમાં કોઈ નિહાળ્યું ન હતું. સેબીએ પછી હિંડનબર્ગ વિરુદ્ધ ગત મહિને નોટીસ ઈસ્સુ કરી હતી તેનો બદલા લેવા માટે અમેરિકન કંપનીએ નવો પાયાવિહારો રિપોર્ટ બાંધ્યો હતો.

આક્ષેપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અત્યાચારુથી વડપ્રધાન નરેન્દ્ર મોદીને નફરત કરતી હતી પરંતુ હવે દેશને રવિશંકરે એવો સવાલ ઉઠાવ્યો હતો કે ભૂતકાળમાં ભારત દાણા-દાણા નફરત કરવા લાગી છે. ભારતીય માટે મોહતાજ હતું તે યુગમાં કોંગ્રેસ દેશને કોઈ લઈ જવા માંગે છે.

ઈન્વેસ્ટરોને જ સીધી મોટી પરેશાની થઈ શકે છે. ભારતમાં નાના ઈન્વેસ્ટરોની રાંચના સંકોચો છે. તેમને કોઈ એવો સવાલ ઉઠાવ્યો હતો કે ભૂતકાળમાં ભારત દાણા-દાણા નફરત કરવા લાગી છે. ભારતીય માટે મોહતાજ હતું તે યુગમાં કોંગ્રેસ દેશને કોઈ લઈ જવા માંગે છે.

IN THE COURT OF HONORABLE JUDGE SHRI D.A. VORA SIR COURT NO. 05 PUBLIC SUMMONS IN THE COURT OF COMMERCIAL COURT AT CITY CIVIL COURT OF AHMEDABAD COMMERCIAL CIVIL SUIT NO. 4652022 EXH. 11

Plaintiff: Punjab National Bank Having its head office at Plot No. 4, Sector-10, Dwarka, New Delhi-110075 and Inter Alia branch office at Circle Sastra, 6th Floor, Gujarat Bhavan, Ellisbridge, Ashram Road, Ahmedabad, Gujarat - 380006.

VERSUS

Defendant: 1. Smt. Ankababen Rajeshkumar Pokar - Prop. of M/s. Ramdev Disposable 102, Welcome Residency, Meghraj Park, Taluka Modasa - 383315. Also at: 125, GIDC, Ganeshpur, Dist. Aravalli, Modasa - 383315.

Defendant: 2. Sh. Dipak Kumar Patel A-304, Ushv Heights, Meghraj Park, Modasa.

Suit Valued at Rs. 11,70,801.35

Whereas your defendant is/are hereby informed that the summons issued against you by this court through bailiff and/or Registrar Post-Ad. has returned unserved subsequently, and as your current whereabouts are unknown, hence in the consequence court ordered this summons is published.

Whereas Plaintiff above named has instituted a suit relating to a commercial dispute against you and you are hereby summoned to file a written statement within 30 days of the date of this summons and in case you fail to file the written statement within 30 days, you shall be allowed to file the written statement on such other days, as may be specified by the court, for reasons to be recorded in writing and on payment of such costs as the court deems fit, but which shall not be more than 120 days from the date of service of summons. On expiry of one hundred and twenty days from the date of service of summons you shall forfeit the right to file the written statement and the court shall not allow the written statement to be taken on record.

Whereas Plaintiff above named has instituted a suit relating to a commercial dispute against you and you are hereby summoned to file a written statement within 30 days of the date of this summons and in case you fail to file the written statement within 30 days, you shall be allowed to file the written statement on such other days, as may be specified by the court, for reasons to be recorded in writing and on payment of such costs as the court deems fit, but which shall not be more than 120 days from the date of service of summons. On expiry of one hundred and twenty days from the date of service of summons you shall forfeit the right to file the written statement and the court shall not allow the written statement to be taken on record.

You are required to appear in this Court in person, or by a pleader duly instructed, and to answer all material questions relating to suit, or who shall be accompanied by some person able to answer the said question, on the 17 day of August of 2024 at 11:00 O'Clock in the fore noon, to answer the claim lodged by the applicant seeking interim injunction as prayed and further you are hereby to produce on the said day all documents in your possession or power upon which you base your defense or claim for set-off or counter-claim, and where you rely on any other document whether in your possession or power or not, as evidence in support of your defense or claim for set-off, or counter-claim you shall enter such documents in list to be annexed to the written statement.

Witness Shri Ahmedabad Aforsaid, Plaintiff's Advocate - M.B. Suthar. Given under my hand and the seal of the Court on 8th day of August 2024.

(C.M. Mahida) (V.M. Rana) (H.S. Desai) Prepared by Compared by Registrar, City Civil Court. Assistant Superintendent Bhadrar, Ahmedabad

AIROLAM એરો લેમ લિમિટેડ CIN : L20211GJ2007PLC052019 રજ. ઓફિસ : સર્વે નં. ૩૫૫, મનપુર રોડ, ને.હા. નં. ૮, ગામ - ઘરપુર, તાલુકો - પ્રીતિજી, હિંમતનગર, ગુજરાત-૩૮૩૧૨૦. Ph : +91 2270-240527/3. E-mail : csl@airolam.com. Website : www.airolam.com

૧૫મી વાર્ષિક સામાન્ય રાહત આઈટી અને લોક કલોગરની નોટીસ

નોટીસ લખાવવામાં આવે છે કે :-

- એરો લેમ લિમિટેડ (કંપની) ના સભ્યોની ૧૫મી વાર્ષિક સામાન્ય રાહત (એકઝેમ), મંજૂરાવાર, ૦૮મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ રાત્રી ૦૮:૦૦ કલાકે, સર્વે નં. ૩૫૫, મનપુર રોડ, ને.હા. નં. ૮, ગામ - ઘરપુર, તાલુકો - પ્રીતિજી, હિંમતનગર, ગુજરાત-૩૮૩૧૨૦ - ૮૮૩૧ ના રોજ તારીખ પખી ઓગસ્ટ, ૨૦૨૪ ની એકઝેમની નોટીસ આપ્યું મુજબ કરવામાં આવશે. આ નોટીસ અંગે વધુ માહિતી માટે કંપનીના વેબસાઈટ પર વેબસાઈટ પેજ પર મુજબના મુદ્દાઓને સંબંધિત રીતે જોવા મળે છે.

- નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અંગે એકઝેમ અને વાર્ષિક અહેવાલની નોટીસ કંપની / ડિપોઝિટોરી સહભાગીનો સાથે ઈમેલ કરવામાં આવી છે અને વાર્ષિક અહેવાલની નોટીસ કંપની / ડિપોઝિટોરી સહભાગીનો સાથે ઈમેલ કરવામાં આવી છે અને વાર્ષિક અહેવાલની નોટીસ કંપની / ડિપોઝિટોરી સહભાગીનો સાથે ઈમેલ કરવામાં આવી છે.
- લીન ઈન-ટાઈમ ઈન્ડિયા પ્રા. લિ. ("LIPPL") ની ઈલેક્ટ્રોનિક વિધિ દ્વારા એકઝેમની નોટીસમાં જણાવ્યું મુજબ કરવો કે તારીખ એટલે કે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ પ્રથમ અથવા વિનિયમિત કરવામાં આવી છે. જે સભ્યોએ તેમનું ઈ-વોટિંગ કરવા માટે જોઈએ તે તારાજિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

- કંપનીની વાર્ષિક અહેવાલ સભાની સૂચના પત્ર સાથે તૈયાર કરવામાં આવી છે.
- કંપનીની વાર્ષિક અહેવાલ સભાની સૂચના પત્ર સાથે તૈયાર કરવામાં આવી છે.
- કંપનીની વાર્ષિક અહેવાલ સભાની સૂચના પત્ર સાથે તૈયાર કરવામાં આવી છે.
- કંપનીની વાર્ષિક અહેવાલ સભાની સૂચના પત્ર સાથે તૈયાર કરવામાં આવી છે.

- એકઝેમની નોટીસ કંપનીની વેબસાઈટ www.airolam.com પર ઉપલબ્ધ છે.
- કંપનીની વાર્ષિક અહેવાલ અને શેર ટ્રાન્ઝેક્શન સંબંધિત માહિતી સભાના સભ્ય માટે મુખ્યવાર, ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ થી મેળવવામાં, ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી મુજબ છે.

અધિકારી ઓફ રિજીસ્ટ્રારના આરોપી, ઓફ રીજીસ્ટ્રાર વતી, સર્વિસ/ સિનલેટર કોર્પોરેશન, મિલિટીયા, (કંપનીના સચિવ અને અધ્યક્ષના અધિકારી)

સમય : પ્રતિબિધ તારીખ : ૦૫.૦૮.૨૦૨૪

દી આદર્શ કો-ઓ. ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ લી. રજ. સુરભ્ય ઓપરેટિંગ, વિજામ બસ સ્ટેન્ડ પાસે, જોગલપારક રોડ, હીડાસ્ટ, અમદાવાદ-૫૦. ફોન : ૨૫૪૬૭૭૨૨

વાર્ષિક સામાન્ય રાહત આઈટી અને લોક કલોગરની નોટીસ

દી આદર્શ કો-ઓ. ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ લી. ના તમામ સહભાગીઓને જણાવવામાં આવે છે કે સંસ્થાની ૪૦મી વાર્ષિક સામાન્ય રાહત તા. ૨૮-૦૮-૨૦૨૪ નો લુધવાર ના રોજ ભૂષણે ૧૨-૦૦ કલાકે શ્રી પુનિત સેવા આશ્રમ, પુનિત માર્ગ, શ્રી રામજી મંદિર સામે, હિંમતનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ માં મળતો તે દરેક સહભાગી ભાઈ-બહેનોને સમયસર હાજર રહેવા વિનંતી છે. વર્ષ ૨૦૨૩-૨૪ નો વાર્ષિક અહેવાલ સંસ્થાની ઓફિસેથી કામકાજના સમય દરમિયાન મેળવી શકશે.

અમદાવાદ શ્રી ડૉ. હસમુખાબાઈ કે. જોષાણી - (ચેરમેનશ્રી) તા. ૧૨-૦૮-૨૦૨૪ ઓફ ઓફ રિજીસ્ટ્રારની હુકમથી

District Judge-1, Khamgaon, Dist. Buldana. (M.S.) IN THE COURT OF SHRI P.P. Kulkarni District Judge-2 and Addl. Sessions Judge, Khamgaon, District Buldana. M.A.C.P./43/2021 Notice of disclosure F.F.28-08-2024

Janardan Pundlik Dhurandhar Vs Rujifarinth

Nos. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159, 160, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170, 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179, 180, 181, 182, 183, 184, 185, 186, 187, 188, 189, 190, 191, 192, 193, 194, 195, 196, 197, 198, 199, 200, 201, 202, 203, 204, 205, 206, 207, 208, 209, 210, 211, 212, 213, 214, 215, 216, 217, 218, 219, 220, 221, 222, 223, 224, 225, 226, 227, 228, 229, 230, 231, 232, 233, 234, 235, 236, 237, 238, 239, 240, 241, 242, 243, 244, 245, 246, 247, 248, 249, 250, 251, 252, 253, 254, 255, 256, 257, 258, 259, 260, 261, 262, 263, 264, 265, 266, 267, 268, 269, 270, 271, 272, 273, 274, 275, 276, 277, 278, 279, 280, 281, 282, 283, 284, 285, 286, 287, 288, 289, 290, 291, 292, 293, 294, 295, 296, 297, 298, 299, 300, 301, 302, 303, 304, 305, 306, 307, 308, 309, 310, 311, 312, 313, 314, 315, 316, 317, 318, 319, 320, 321, 322, 323, 324, 325, 326, 327, 328, 329, 330, 331, 332, 333, 334, 335, 336, 337, 338, 339, 340, 341, 342, 343, 344, 345, 346, 347, 348, 349, 350, 351, 352, 353, 354, 355, 356, 357, 358, 359, 360, 361, 362, 363, 364, 365, 366, 367, 368, 369, 370, 371, 372, 373, 374, 375, 376, 377, 378, 379, 380, 381, 382, 383, 384, 385, 386, 387, 388, 389, 390, 391, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 400, 401, 402, 403, 404, 405, 406, 407, 408, 409, 410, 411, 412, 413, 414, 415, 416, 417, 418, 419, 420, 421, 422, 423, 424, 425, 426, 427, 428, 429, 430, 431, 432, 433, 434, 435, 436, 437, 438, 439, 440, 441, 442, 443, 444, 445, 446, 447, 448, 449, 450, 451, 452, 453, 454, 455, 456, 457, 458, 459, 460, 461, 462, 463, 464, 465, 466, 467, 468, 469, 470, 471, 472, 473, 474, 475, 476, 477, 478, 479, 480, 481, 482, 483, 484, 485, 486, 487, 488, 489, 490, 491, 492, 493, 494, 495, 496, 497, 498, 499, 500, 501, 502, 503, 504, 505, 506, 507, 508, 509, 510, 511, 512, 513, 514, 515, 516, 517, 518, 519, 520, 521, 522, 523, 524, 525, 526, 527, 528, 529, 530, 531, 532, 533, 534, 535, 536, 537, 538, 539, 540, 541, 542, 543, 544, 545, 546, 547, 548, 549, 550, 551, 552, 553, 554, 555, 556, 557, 558, 559, 560, 561, 562, 563, 564, 565, 566, 567, 568, 569, 570, 571, 572, 573, 574, 575, 576, 577, 578, 579, 580, 581, 582, 583, 584, 585, 586, 587, 588, 589, 590, 591, 592, 593, 594, 595, 596, 597, 598, 599, 600, 601, 602, 603, 604, 605, 606, 607, 608, 609, 610, 611, 612, 613, 614, 615, 616, 617, 618, 619, 620, 621, 622, 623, 624, 625, 626, 627, 628, 629, 630, 631, 632, 633, 634, 635, 636, 637, 638, 639, 640, 641, 642, 643, 644, 645, 646, 647, 648, 649, 650, 651, 652, 653, 654, 655, 656, 657, 658, 659, 660, 661, 662, 663, 664, 665, 666, 667, 668, 669, 670, 671, 672, 673, 674, 675, 676, 677, 678, 679, 680, 681, 682, 683, 684, 685, 686, 687, 688, 689, 690, 691, 692, 693, 694, 695, 696, 697, 698, 699, 700, 701, 702, 703, 704, 705, 706, 707, 708, 709, 710, 711, 712, 713, 714, 715, 716, 717, 718, 719, 720, 721, 722, 723, 724, 725, 726, 727, 728, 729, 730, 731, 732, 733, 734, 735, 736, 737, 738, 739, 740, 741, 742, 743, 744, 745, 746, 747, 748, 749, 750, 751, 752, 753, 754, 755, 756, 757, 758, 759, 760, 761, 762, 763, 764, 765, 766, 767, 768, 769, 770, 771, 772, 773, 774, 775, 776, 777, 778, 779, 780, 781, 782, 783, 784, 785, 786, 787, 788, 789, 790, 791, 792, 793, 794, 795, 796, 797, 798, 799, 800, 801, 802, 803, 804, 805, 806, 807, 808, 809, 810, 811, 812, 813, 814, 815, 816, 817, 818, 819, 820, 821, 822, 823, 824, 825, 826, 827, 828, 829, 830, 831, 832, 833, 834, 835, 836, 837, 838, 839, 840, 841, 842, 843, 844, 845, 846, 847, 848, 849, 850, 851, 852, 853, 854, 855, 856, 857, 858, 859, 860, 861, 862, 863, 864, 865, 866, 867, 868, 869, 870, 871, 872, 873, 874, 875, 876, 877, 878, 879, 880, 881, 882, 883, 884, 885, 886, 887, 888, 889, 890, 891, 892, 893, 894, 895, 896, 897, 898, 899, 900, 901, 902, 903, 904, 905, 906, 907, 908, 909, 910, 911, 912, 913, 914, 915, 916, 917, 918, 919, 920, 921, 922, 923, 924, 925, 926, 927, 928, 929, 930, 931, 932, 933, 934, 935, 936, 937, 938, 939, 940, 941, 942, 943, 944, 945, 946, 947, 948, 949, 950, 951, 952, 953, 954, 955, 956, 957, 958, 959, 960, 961, 962, 963, 964, 965, 966, 967, 968, 969, 970, 971, 972, 973, 974, 975, 976, 977, 978, 979, 980, 981, 982, 983, 984, 985, 986, 987, 988, 989, 990, 991, 992, 993, 994, 995, 996, 997, 998, 999, 1000.

K.Z. LEASING AND FINANCE LIMITED CIN : L65910GJ1986PLC00864 Regd. Office: Dasha Chambers, B/h. Kadwa Palidar Wadi, Usmanpura, Ashram Road, Ahmedabad - 380014. Phone: 079-27543200

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER AND THREE MONTHS ENDED ON 30TH JUNE, 2024. (Rs.in Lacs)

Particulars	Quarter ended on 30/06/2024 (Unaudited)	Quarter ended on 30/06/2023 (Unaudited)
1 Total Income from Operations	336.68	279.52
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and /or Extraordinary items)	289.39	233.18
3 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and /or Extraordinary items)	289.39	223.21
4 Net Profit / (Loss) for the period after tax	213.66	165.18
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)	269.10	229.32
6 Paid-up Equity Share Capital	304.12	304.12
7 Reserves (excluding Redemption Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	---	---
8 Earnings per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	7.03	5.43

Notes: (1) The above Un-Audited Financial statement for quarter ended June 30, 2024 has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 12th August, 2024 and Statutory Auditors of the Company have carried out limited review audit of the same. (2) This statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules 2015 (IND AS) prescribed under section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable. (3) IND AS 108 relating to segment wise reporting is Not Applicable as the Company operates in one primary segment i.e "Finance Segment". (4) Figures of previous year / quarter were regrouped / rearranged wherever necessary.

SAYAJI સયાજી ઘડસ્ટ્રીજી લિમિટેડ CIN : L99999GJ1941PLC00471 રજ. ઓફિસ : મેઘા મહેલ, પો. ઓ. ૭૭૧૫૧, અમદાવાદ-૩૮૨૪૩૦ ફોન : +91 79 22901581 - 85

જાહેર સૂચના

આથી સૂચના આપવામાં આવ